

ચીકુની આધુનિક ખેતી પદ્ધતિ



ડૉ. એ. પી. પટેલ * ડૉ. પી. કે. મોદી
ડૉ. કે. ડી. બિસને * શ્રી કે. વી. મકવાણા
ડૉ. વૃત્તિ પટેલ

આઈસીએઆર-અભિલ ભારતીય સંકલિત સંશોધન યોજના (ફળ)

ફળ સંશોધન કેન્દ્ર
નવસારી કૃષિ યુનિવર્સિટી
ગાણાંદેવી - ઉદ્દુકુદો, ગુજરાત (ગુજરાત)



ચીકુની આધુનિક ખેતી પદ્ધતિ

પ્રસ્તાવના:

ચીકુભારતમાં કેરી, કેળા, લીબુ, સફરજન અને જમરૂખ પદ્ધી છઢા કરુનું સ્થાન ધરાવે છે. ભારતમાં તેની ખેતી ખાવાના ફળ માટે થાય છે. જ્યારે દક્ષિણ અમેરિકામાં ચ્યુર્ટ્યુગમ બનાવવાના પાયાના પદાર્થ તરીકે ચીકલ (ગુઢા પચ્ચી) મેળવવા માટે થાય છે. આપણા ગુજરાત રાજ્યમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ભરૂચ અને નર્મદા તેમજ જુનાગઢ જીલ્લામાં ચીકુની ખેતી થાય છે. ગુજરાતમાં આશારે ૨૬ હજાર હેક્ટરમાં ચીકુની ખેતી થાય છે અને તેમાંથી પ્રતિ હેક્ટરે ૧૦ મેટ્રિક ટનની ઉત્પાદકતા સાથે ૨.૫૭ હજાર મેટ્રિક ટનનું વાર્ષિક ઉત્પાદન થાય છે. ચીકુખાવામાં ખૂબ જ મીઠાં, માવો પોચો અને કણીદાર હોય છે. પાકા ચીકુમાંથી સુકવણીથી ચીપ્સ, ચીકુહલવો, ચીકુમુરબ્બો, ચીકુજ્યુસ, સ્કવોશ, સિરપ, જામ, ટ્રોફી, કેન્દી અને મિલ્ક શેક બનાવી શકાય છે.

જાતો:

ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે કાલીપતી જાતનું વાવેતર જોવા મળે છે. શિયાળામાં વધુ ફળો ઉત્પાદન માટે મીઠા અને ટકાઉ શક્કિત ઘણી જ સારી છે. ચીકુની મુરબ્બા, છિકેટબોલ, ભૂરીપતી, પીળીપતી, જેવી જાતોનું ધૂટુછવાયું વાવેતર જોવા મળે છે. ગુજરાતમાં ખાસ કરીને વલસાડ અને નવસારી જીલ્લામાં ચીકુનું સૌથી વધારે વાવેતર થાય છે અને તેમાં પણ કાલીપતી જાતનું પ્રમાણ સૌથી વધારે છે. કાલીપતી જાતના પાન ઘેરા લીલા રંગના, પહોળા અને જાડા હોય છે. ફળ લંબગોળ અથવા ગોળ આકારના, મીઠા અને સુંગધી માવો ધરાવે છે. ફળનું સરેરાશ વજન ૮૦ ગ્રામ જેટલું હોય છે.

હવામાન અને જમીન:

દરિયા કિનારાનું ગરમ અને બેજવાળું હવામાન ખૂબ જ માફક આવે છે. ૧૮° થી ૩૫° સે.ગ્રે. ઉષ્ણતામાન ખૂબ જ અનુકૂળ રહે છે. ૧૦° સે. ગ્રે. થી નીચા તાપમાને ચીકુના ઝડનો વિકાસ અટકે છે તેમજ ફળો નાના રહે છે અને મોડા પરિપક્વ થાય છે. ૪૦° સે. ગ્રે. તાપમાને ચીકુના ઝૂલ તથા નાના ફળ ખરી પડે છે. ચીકુને સારા નિતારવાળી, ઉડી, ગોરાડુ, બેસર કે મધ્યમકાળી જમીન વધુ અનુકૂળ છે.

સંવર્ધન:

ચીકુનું સંવર્ધન બીજ, ગુટી, ભેટકલમ અને નૂતન કલમ પદ્ધતિથી કરી શકાય છે. અભ્યાસના પરિણામો પરથી ચીકુની કલમ રાયણના મુલકાંડ ઉપર કરવાની ભલામણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત મહુડા, બાવાબદામ અને મીટ્રી નો પણ મુલકાંડ તરીકે ઉપયોગ કરી શકાય છે.

રોપણી:

ચીકુની રોપણી 10×10 મીટરના અંતરે કરવાની ભલામણ છે. ચીકુની કાલીપતી જાત ઉપર લેવામાં આવેલ વાવેતર અંતરના અખતરાના પરિણામો દર્શાવે છે કે શરૂઆતના ૧૩ વર્ષ સુધી એકમ વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવવા માટે જાડની રોપણી 4×4 મીટરના અંતરે કરવાથી વધુ ઉત્પાદન મળે છે.

ચીકુની રોપણી કરવા માટે ઉનાળામાં ભલામણ કરેલ અંતરે $1 \times 1 \times 1$ મીટરના ખાડા કરવા. ખાડાઓને ૧૫ દિવસ તપવા દેવા, ત્યાર બાદ ખાડા દીઠ ૨૦-૨૫ કિ.ગ્રા. છાણિયું ખાતર માટી સાથે મિશ્ર કરી ખાડા પૂરી દેવા અને ખાડાની વચ્ચ્યોવચ્ચ નિશાની કરી રાખવી. ચોમાસામાં સારો વરસાદ થયા બાદ પસંદ કરેલી કલમો નિશાની કરેલ જગ્યાએ રોપવી. સામાન્ય રીતે ચીકુની રોપણી જૂન થી ડિસેમ્બર મહિના સુધી કરી શકાય છે.

ખાતર:

પ્રથમ વર્ષે વાવેતર કરેલ ચીકુના જાડ દીઠ ૧૦ કિ.ગ્રા. છાણિયું ખાતર જૂન માસમાં અને પૂર્તિ ખાતર તરીકે ૧૦૦ ગ્રામ નાઈટ્રોજન (૨૧૬ ગ્રામ યુરિયા), ૫૦ ગ્રામ ફોસ્ફરસ (૩૦૦ ગ્રામ એસ.એસ.પી.) અને ૫૦ ગ્રામ પોટાશ (૮૦ ગ્રામ મ્યુરેટ ઓફ પોટાશ) ત્રણ સરખા હપ્તામાં જૂન, ઓક્ટોબર અને ફેબ્રુઆરી માસમાં આપવું. ત્યારબાદ દર વર્ષે ઉપરોક્ત જથ્થો ઉમેરીને નવ વર્ષ સુધી આપવો.

ચીકુની કાલીપતી જાતના પુખ્ત વયના જાડોની વાતી ધરાવતા ખેડૂતોને નવી ભલામણ કરવામાં આવે છે કે ચીકુના જાડનાં ફરતે થડથી ૧.૫ થી ૨.૦ મીટર પરીધમાં ૧૫ સે.મી. પહોળી અને ૧૫ સે.મી. ઉડાઈ ની રીત બનાવવી અને તેમાં રસાયાણિક ખાતરો ૧૦૦૦-૫૦૦-૫૦૦ ગ્રામ ના.ફો.પો. / જાડ બે સરખા હપ્તામાં જૂન અને ઓક્ટોબર માસમાં આપવાને બદલે ત્રણ હપ્તામાં ૨૫ ટકા (૨૫૦-૧૨૫-૧૨૫ ગ્રામ ના.ફો.પો./જાડ) સાથે ૧૦૦ કિ.લો./જાડ દીઠ છાણિયું ખાતર જૂન માસમાં, ફરીથી ૨૫ ટકા (૨૫૦-૧૨૫-૧૨૫ ગ્રામ ના.ફો.પો./જાડ) ફેબ્રુઆરી માસમાં આપવાથી શિયાળાની ઝતુમાં ઉનાળાની ઝતુની સરખામણીમાં વધુ ઉત્પાદન સહીત વધુ નફો મળે છે.

ખાતર આપવાનો સમય	તત્વના આપવાના ટકા (%)			ખાતરનો જથ્થો (કિલો/છોડ)		
	નાઈટ્રોજન	ફોસ્ફરસ	પોટાશ	યુરિયા	એસ.એસ.પી.	મ્યુરેટ ઓફ પોટાશ
જૂન	૨૫	૨૫	૨૫	૦.૪૪૦	૦.૭૫૦	૦.૨૫૦
ઓક્ટોબર	૨૫	૨૫	૨૫	૦.૪૪૦	૦.૭૫૦	૦.૨૫૦
ફેબ્રુઆરી	૫૦	૫૦	૫૦	૧.૦૮	૧.૫૦૦	૦.૪૦૦
				૨.૧૬	૩.૦૦	૧.૦૦

ચીકુની કાલીપતી જાતના પુખ્જ વયના ઝડને રાસાયણિક ખાતરની ભલામણના ૮૦ ટકા (૮૦૦:૪૦૦:૪૦૦ ગ્રામ એન.પી.કે. પ્રતિ ઝડ) ચાર હપ્તામાં જુલાઈ, સપ્ટેમ્બર, નવેમ્બર અને ફેબ્રુઆરી માસમાં નીચેની ટેબલ મુજબ અને ૧૫ કિલો વર્મિકમ્પોસ્ટ સાથે જૈવિક ખાતર એજોટોબેક્ટર અને પી.એસ.બી. ૧૦૦ મી.લી. પ્રતિ ઝડ જુલાઈ માસમાં અને ગ્રેડ-૪ સૂક્ષ્મ પોષક તત્વોનો ૦.૫ ટકાનો છંટકાવ ઓક્ટોબર માસમાં કરવાથી શિયાળુ ઝતુમાં ઉત્પાદન મળે છે અને આવકમાં વધારો થાય છે.

ખાતર આપવાનો સમય અને અવસ્થા	રાસાયણિક ખાતરની ભલામણનો ૮૦% જથ્થો			
	નવી કુપણ નિકળે ત્યારે (જુલાઈ)	ફળ બેસે ત્યારે (સપ્ટેમ્બર)	ફળનો વિકાસ થાય ત્યારે (નવેમ્બર)	નવાફૂલ આવે અને ફળનો વિકાસ થાય ત્યારે (ફેબ્રુઆરી)
એન.પી.કે. (ટકા)	૩૨:૪૦:૨૦	૧૬:૦૦:૨૦	૧૬:૪૦:૨૦	૧૬:૦૦:૨૦
એન.પી.કે. (ગ્રામ/ઝડ)	૩૨૦:૨૦૦: ૧૦૦	૧૬૦:૦૦ ૧૦૦	૧૬૦:૨૦૦: ૧૦૦	૧૬૦:૦૦: ૧૦૦
યુરીયા (ગ્રામ/ઝડ)	૭૦૦	૩૫૦	૩૫૦	૩૫૦
સિંગલ સુપરફોર્સેટ (ગ્રામ/ઝડ)	૧૨૫૦	૦૦	૧૨૫૦	૦૦
ઘૂરેટ ઓફ પોટાશ (ગ્રામ/ઝડ)	૧૭૦	૧૭૦	૧૭૦	૧૭૦

બિનપિયત વિસ્તારમાં ઝડ દીઠ ૧૫૦૦ ગ્રામ નાઈટ્રોજન (૩ કિ.ગ્રા. યુરિયા) વરસાદ શરૂ થાય કે તરત ૪ આપવો. ફોસ્ફરસ અને પોટાશ યુક્ત ખાતરો જમીનના પૃથકુકરણના આધારે જરૂરિયાત મુજબ આપવા. ચીકુની સેન્દ્રીય ખેતી માટે પુખ્જવયના ઝડને ૨૦૦ કિ.ગ્રા. ધાણિયું ખાતર + ૫૦ કિ.ગ્રા. વર્મિકમ્પોસ્ટ આપી શકાય.

પિયત:

ચીકુના પુખ્જ ઉમરના ઝડને શિયાળામાં ૩૦ દિવસે અને ઉનાળામાં ૧૫ દિવસના અંતરે પિયત આપવાની ભલામણ કરવામાં આવેલ છે. ૨૫ક સિંચાઈ પદ્ધતિમાં શરૂઆતના બે વર્ષ સુધી થડથી ૫૦ સે. મી. દુર પ્રતિ કલાકના ૪ લીટરની ક્ષમતાવાળા ૨ ડ્રીપર અને બે થી પાંચ વર્ષ સુધી ૪ ડ્રીપર થડથી ૧ મીટર દૂર ગોઠવી શિયાળામાં ૪ કલાક અને ઉનાળામાં ૭ કલાક સુધી આંતરે દિવસે ચલાવવી. જ્યારે ૮ થી ૧૨ વર્ષના ઝડ માટે નળીઓ થડથી ૧.૫ થી ૨.૦ મીટર દૂર ગોઠવી પ્રતિ કલાકના ૮ લીટરની ક્ષમતાવાળા ૮ ડ્રીપર એકબીજાથી ૪૦ સે. મી. દુર ગોઠવી શિયાળામાં ૨ કલાક અને ઉનાળામાં ૩ કલાક એકાંતર દિવસે ચલાવવી.

પાછળી માવજત :

પુખ્ત વયના જાડમાં રોગિષ, ચાપટી, પાકટ અને જમીન સાથે અડી ગયેલ ડાળીઓની છાંટણી કરવી તેમજ વાંદા જેવી પરોપજીવી વનસ્પતિની વૃદ્ધિ ડાળીઓ ઉપર જોવા મળે તો તે કાપી નાંખવી. ફળવધારે બેસે તે માટે વૃદ્ધિ નિયંત્રકો જેવા કે એન.એ.એ. ૫૦ પી.પી.એમ. (૧ લીટર પાણીમાં ૫૦ મિ.ગ્રા. પાઉડર) નું પ્રવાહી ફૂલ આવવાના સમયે ૧૫ દિવસના અંતરે ત્રણ વખત છાંટવાથી ત૦ ટકા જેટલું ફળનું વધુ ઉત્પાદન જોવા મળે છે.

આંતરપાક:

૧૦ x ૧૦ મીટરના અંતરે રોપણી કરેલ ચીકુના ખેતરમાં ૧૦ વર્ષ સુધી અને ૫ x ૫ મીટરે રોપણી કરેલ ખેતરમાં ૫ વર્ષ સુધી શાકભાજીના પાકો જેવા કે રીગણા, મરચી, ટામેટી, સુરણા, રતાળુ, શક્કરિયા, આદુ વિગેરે તથા ફળપાકો જેવાકે કેળ અને પપૈયા આંતરપાકો તરીકે લઈ વધારાની પૂરક આવક મેળવી શકાય છે.

ફળવધારણ અને ફળ વિકાસ:

સપ્ટેમ્બર માસ દરમ્યાન નરી આંખે જોઈ શકાય તેવી કળીથી શરૂઆત કરી તોડવા લાયક પરિપક્વ ફળો તૈયાર થવા ઉત્તર દિવસ જેટલો સમય લાગે છે, જેમાં ૧૫ ટકા જેટલો જ ફલન છે. એ સમય દરમ્યાન તૈયાર થયેલ ફળોનો આકાર લંબગોળ જોવા મળેલ છે. આ ફળો જુલાઈ ઓગસ્ટ માસમાં જોવા મળે છે.

ફરીથી ઉપર મુજબનો અભ્યાસ માર્યથી શરૂ કરતા બીજા વર્ષે ૩૦૦ દિવસ બાદ જાન્યુઆરી માસમાં ફળો તૈયાર થાય છે. જેમાં ૧૦ ટકા જેટલા ફળો બેસે છે. એ સમયગાળા દરમ્યાન તૈયાર થયેલ ફળોનો આકાર ગોળ જોવા મળેલ છે. આ ફળો જાન્યુઆરી - ફેબ્રુઆરી માસમાં જોવા મળે છે.

ચીકુના પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની અસર

ચીકુના પુખ્ત વયના જાડ ઉપર સી સી સી ૧૦૦ મિલી ગ્રામ/લિટર (૧૦ ગ્રામ/૧૦૦ લીટર પાણીમાં) નો એપ્રિલ માસમાં અને જીબેલીક એસીડ ૫૦ મિલી ગ્રામ/લિટર (૧૦ ગ્રામ/૧૦૦ લિટર પાણીમાં) નો સપ્ટેમ્બર અને નવેમ્બર માસમાં છાંટકાવ કરવાથી ચીકુના ફળનું ઉત્પાદન અને ગુણવત્તા સારી થાય છે.

ચીકુની ૪૦ વર્ષથી વધુ ઉમરના કાલીપતી જાતના વાડી ધરાવતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે જાડના ટોચના ૧ મીટર ભાગને એક વખત ડિસેમ્બર મહિના દરમ્યાન કાપીને દૂર કરવામાં આવે તો ક્રમશ: ઉત્પાદન અને ચોખ્યી આવકમાં વધારો થાય છે.

પાક સંરક્ષણ:

જીવાતો:

- ૧) ચીકુની કળી કોરનાર ઈયળ: આ જીવાત ની ઈયળ રતાશ પડતી ઘેરા બદામી રંગના માથાવાળી ચીકુની કળી તથા ફૂલમાં કાણાં પાડી અંદરનો ગર્ભ કોરી ખાય છે પરિણામે ફળો બેસતાં નથી.

નુકસાનવાળી કળીની ઉપર ફુદા તથા ઈયળની હગાર જોવા મળે છે. નવી પીલવાડી વખતે કુમળા પાનને ખાઈને પણ નુકશાન કરે છે. આ જીવાતનો ઉપદ્વા આખા વર્ષ દરમ્યાન જોવા મળે છે. પરંતુ માર્યાથી જૂન મહિના દરમ્યાન નુકશાન વધતું જાય છે.

નિયંત્રણ: કાળી તુલસીના પાનના રસ સાથેની જેરી પ્રલોભીકા નર આકર્ષક માં રાખી ઉપયોગ કરવાથી આ જીવાતના ઉપદ્વાને ઓછો કરી શકાય છે.

૨) **ચીકુ મોથ :** આ જીવાતની ઈયળ જાંખા લીલા અથવા બદામી રંગની હોય છે. સામાન્ય રીતે પાનનાં ઝૂમખાં બનાવી તેમાં ભરાઈને પાનનું હરિત દ્રવ્ય ખાઈને નુકશાન કરે છે. ખાસ કરીને કળી તથા ફૂલોને નીચેથી કાણું પાડી કોરી ખાઈને વધુ નુકશાન કરે છે. નાના ફળોમાં ડીટા આગળ કાણું પાડીને પણ નુકશાન કરે છે. આ જીવાતનો ઉપદ્વા આખુ વર્ષ જોવા મળે છે. મે-જૂન તથા ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ઉપદ્વા વધુ જોવા મળે છે.

નિયંત્રણ: ઉપદ્વાનિઃના ઝૂમખા ઈયળ સહિત તોડીને નાશ કરવો.

૩) **ફળમાખી :** ફળમાખી બદામી અને રંગીન ડાઘા ધરાવતી પારદર્શક પાંખોવાળી હોય છે. માદા ફળમાખી પરિપક્વ થવા આવેલાં ફળોમાં પોતાનું અંડિન્ક્ષેપક દાખલ કરી ફળમાં ઈડા મૂકે છે. ઈડામાંથી નીકળેલા કીડા ફળની અંદરનો ગર્ભ ખાઈને નુકશાન કરે છે. એપ્રિલ થી જૂલાઈ માસ દરમ્યાન ઉપદ્વા વધુ જોવા મળે છે. દક્ષિણ ગુજરાતમાં આંબા અને ચીકુના બેંગુ વાવેતર થતું હોવાથી કેરીમાં નુકશાન કર્યા પછી ચીકુમાં નુકશાન કરે છે.

નિયંત્રણ: વારીમાં સ્વચ્છતા રાખવી અને સડેલાં ફળો ખાડામાં દાટી મિથાઈલ પેરાથિયોન પાઉડર નાંખવો. નૌરોજી મિથાઈલ યુજીનોલ યુકટ ટ્રેપ દર ૧૦ જાડ દીઠ એક પ્રમાણો અથવા હેક્ટરે ૧૦ ટ્રેપ મૂકવાથી નર ફળમાખીને આકર્ષિને વસ્તી વધતી અટકાવી શકાય છે. સામૂહિક રીતે આ ટ્રેપો મૂકવાથી અસરકારક નિયંત્રણ થઈ શકે છે. આ ટ્રેપ જમીનથી ચાર ફુટ ઉચ્ચાઈએ મૂકવા અને દર ત્રણ મહિને બલોક બદલવા.

૪) **બીજ કોરી ખાનારી ઈયળ :** આ જીવાતની ઈડાંમાથી નીકળેલી ઈયળ ફળની અંદર કાણું પાડી બીજ સુધી પહોંચી જાય છે અને મધ્યમથી મોટા કદના ફળોનાં બીજનો અંદરનો ભાગ ખાય છે. ઈયળ અવસ્થા પુરી થતાં ફળમાં કાણું પાડી બહાર આવી પાન પર કોશેટો બનાવે છે. ફળ પરનાં આવા કાણાંમાંથી ફૂગ તથા અન્ય જીવાતો ફળમાં દાખલ થઈ નુકશાન કરે છે. ઓક્ટોબર થી ડીસેમ્બર દરમ્યાન ઉપદ્વા વધુ જોવા મળે છે.

૫) **ચીકુનુ પાનકોરિયું ઈયળ :** ઈડાંમાથી નીકળેલી ઈયળ કુમળા પાનના બે પડ વચ્ચે દાખલ થઈ અંદરની પેશીઓ ખાઈ પાન પર સર્પાકાર પારદર્શક રેખાઓ ઉપસાવે છે. આ ઉપરાંત ઈયળ પાનના ડીટા તરફથી ધાર વાળી તેમાં ભરાઈને પાનના હરીતદ્રવ્ય ખાઈને નુકશાન કરે છે. કોશેટો વાળેલ પાનની ધારની અંદર બનાવે છે. આ જીવાતો નવી પીલવાડી ને વધતાં ઓછા

પ્રમાણમાં નુકશાન કરતી હોય છે. આ જીવાતનો ઉપદ્ધતિ ખાસ કરીને સાપેભર થી ડીસેભર દરમ્યાન વધુ જોવા મળે છે.

નિયંત્રણ: નાની ઈયળના સમૂહ તથા નુકશાન પામેલ પાનનો નાશ કરવો.

- ૬) **ચીકુના પાન વાળનારી ઈયળ:** નાની ઈયળ શરૂઆતમા ફૂમણાં પાનને મધ્યનસથી કોતરી ખાય છે. બીજી અવસ્થા પછી ઈયળ પાનને મધ્યનસથી વાળી દઈ બે ધારો વચ્ચે જાળું બનાવે છે. ઈયળ આવા વાળેલા પાનમાં જ રહીને પાનના હરીતક્વય ખાઈને નુકશાન કરે છે.
- ૭) **ચીકુફળની કથીરી:** કથીરી ખુબ જ નાની હોય છે જે લખોટા જેવા ફળોથી મોટા ફળોને નુકશાન કરે છે. આ કથીરી ફળો પર ઘસરકા પાડી તેમાંથી નીકળતો રસ ખાય છે. પરિણામે ફળો ખરબયડા અને કાળા રંગના થઈ જાય છે અને ફળોની ગુણવત્તા ઘટે છે.
- નોંધ:-** સામાન્ય રીતે જીવાતો નિયંત્રણ માટે વપરાતી દવાનો છંટકાવ તજજની સલાહ લઈ કરવો.

રોગો :

- ૧) **સુકારો:** આ રોગ કુગથી થાય છે. શરૂઆતમાં ઝડ જાંખા પીળા અને ફીક્કા થઈ ધીમે ધીમે સુકાવા લાગે છે. પાન તોડતા દુધ ન નીકળે. રોગવાળી ડાળી તોડતા વચ્ચે બદામી રંગની લીટી જોવા મળે છે. ખાસ કરીને વરસાદ બંધ થયા પછી સાપેભર-ઓકટોબર માસમાં છૂટાછવાયાં ઝડોને અસર જોવા મળે છે. સમય જતાં આખું ઝડ સુકાઈને મરી જાય છે.

નિયંત્રણ: વાડીમાં પાણી ભરાવા ન દેવું. પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવી.

નોંધ:- સામાન્ય રીતે રોગો નિયંત્રણ માટે વપરાતી દવાનો છંટકાવ તજજની સલાહ લઈ કરવો.

ફળ ઉતારવાં :

ચીકુના ઝડ ઉપર લગભગ બારેમાસ વધતા ઓછા પ્રમાણમાં ફૂલો અને ફળો જોવા મળે છે. સામાન્ય રીતે ઓકટોબર થી જાન્યુઆરી માસના ગાળા દરમ્યાન વધુ ફળ મળે છે. ત્યારબાદ મે માસ સુધી ફળો મળતા રહે છે. ફળની છાલ લીલાને બદલે પીળાશ પડતી જણાય, ફળ ઉપર હાથ ઘસવાથી રેતી જેવો ઝીંખો ભૂકો હાથમાં ચોટે અને ફળની ટોચ પરનો કાંટો સહેજ અડકતાં ખરી પડે ત્યારે ફળો ઉતારવા લાયક ગણાય છે. ઉતારેલ ફળોને કોથળામાં નાખી હલાવવા જેથી ફળ સ્વર્ચ અને ચળકાટ આપશે. કોથળામાં નાંખીને હલાવવાના વિકલ્પે ફળોને પાણીમાં ધોઈ સૂકવવામાં આવે છે. ત્યારબાદ કદ પ્રમાણે વર્ગીકરણ કરીને બજારમાં મોકલવામાં આવે છે.

ઉત્પાદન:

સામાન્ય રીતે પુખ્ન વય (૧૨ થી ૧૫ વર્ષ) ના ઝડ પ્રતિ વર્ષ ૧૨૦ થી ૧૫૦ ક્રિ. ગ્રા. જેટલું ફળનું ઉત્પાદન આપે છે.

મુલ્યવૃદ્ધિ:

ફળોને ઉતાર્યા બાદ ૧૫૦ પી.પી.એમ. જીબ્રેલીક એસિડના દ્રાવણમાં ચ થી ૧૦ મિનિટ બોળ્યા બાદ કાગળના બોક્ષમાં ભરવાથી તેની ટકાઉ શક્તિ વધે છે. નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી ખાતે થયેલ અત્યાસ મુજબ ચીકુને ઉતાર્યા બાદ ૧% ચુનાના દ્રાવણમાં ૫ મિનિટ સુધી રૂબાડી સુકાયા બાદ પાણીમાં ધોવાથી ફળોના દ્રેબાવમાં સુધારો થાય છે અને ટકાઉ શક્તિ વધે છે. બીજા એક અત્યાસ મુજબ ફળોને ઉતાર્યા બાદ ૧૦° સે. ગ્રે. તાપમાને ચ કલાક સુધી પ્રિકુલોગની માવજત આપીને ૫૦ માઈક્રોની ૧.૨ ટકા કાણાવાળી બેગમાં ભરી સીએફબી બોક્સમાં મૂકી ૧૨° સે. ગ્રે. તાપમાને કોલ સ્ટોરેજમાં રાખવાથી ફળોની ગુણવત્તાને અસર થયા વગર ૧૫ દિવસ સુધી સંગ્રહ કરી શકાય છે.




ચીકુની કળી કોરનાર ઈયળ



ચીકુ મોથ



બીજ કોરી ખાનાર ઈયળ



ફળમાખી



ચીકુ પાન વાળનારી ઈયળ



ચીકુનુ પાનકોરિયું ઈયળ